

(કૃપા કરી ફોર્મ સ્પષ્ટ અક્ષરોમાં અને એક જ શાલીમાં ભરો. આ મશીનથી વાંચી શકાતું ફોર્મ છે અને સ્ટેનર થકી પસાર થશે). લાગુ અનુસાર જાનાં પર ☒ નિશાન કરો.
(સંયુક્ત ધારક/કો માટે અલગ સીઆઈએફ ભરવાનું રહેશે) *ફરજિયાત જાનાં

Barcode

મારું/અમારું અકાઉન્ટ તમારા પર ખોલો	Branch Name	શાખા	શાખાનો કોડ:	અરજીની તારીખ
સેવિંગ્સ અકાઉન્ટ	3 0		કરન્ટ અકાઉન્ટ	4 0
ઉપસર્ગ	અગ્રતાનો / આર-કિટ અકાઉન્ટ નંબર		ઉપસર્ગ	અગ્રતાનો / આર-કિટ અકાઉન્ટ નંબર

1. *અરજદાર(રો)નું આખું નામ (દરેક અકાઉન્ટ ધારક માટે અલગ સીઆઈએફ ફોર્મ ભરો)

શીર્ષક	☐ શ્રી	☐ કુમારી	☐ શ્રીમતી	☐ Mx.	☐ ડૉ.	☐ માસ્ટર	☐ અન્ય	(Please specify)												
1જો અરજદાર	F	I	R	S	T		M	I	D	D	L	E								
	L	A	S	T				ક્સ્ટમર આઈડી નં. (જો મોકૂફ લેય)												
2જો અરજદાર	F	I	R	S	T		M	I	D	D	L	E								
	L	A	S	T				ક્સ્ટમર આઈડી નં. (જો મોકૂફ લેય)												
3જો અરજદાર	F	I	R	S	T		M	I	D	D	L	E								
	L	A	S	T				ક્સ્ટમર આઈડી નં. (જો મોકૂફ લેય)												

2. *ખોલાવવાના અકાઉન્ટ(જટ્સ)નો પ્રકાર

☐ સેવિંગ / સેવરી	Scheme Name	☐ કરંટ	Scheme Name
☐ ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી)	Scheme Name	☐ ભવિષ્યલક્ષી એફડી	Scheme Name
☐ રિકર્વિંગ ડિપોઝિટ (આરડી)	Scheme Name	☐ સ્માર્ટ રિકર્વિંગ ડિપોઝિટ (એસડી)	Scheme Name
*એવેરેજ મોનલી / એક્વ્યુલી / ક્યુટીપી	*Average Monthly Balance/ Average Quarterly Balance/ Quarterly Throughput - for Savings & Current Account		

3. *સંચાલનનું માધ્યમ

☐ એકલ ☐ બેમાંથી એક અથવા હયાત ☐ *ગત અથવા હયાત ☐ કોઈ પણ એક અથવા હયાત ☐ સંયુક્ત ☐ સગીર U/g પાલક ☐ અન્ય

(*હયાતને લેણદેણને અધિકાર નહીં)
 (સંયુક્ત એમઓપી માટે ડેબિટ/એટીએમ કાર્ડ/નેટ બેન્કિંગ/મોબાઈલ બેન્કિંગને પહોંચ જારી નહીં કરાશે)

નોંધ: જો અનિવાસી નાગરિક સંયુક્ત ધારક હોય તો સુસંગત ઘોષણા સુપરત કરવાની રહેશે.

4. વ્યવહાર પેટર્ન

*આવક/લંડોળનો સ્રોત ☐ પગાર ☐ વેપાર આવક ☐ રોકાણ આવક ☐ કૃષિ ☐ નિર્ભર ☐ ફી/કમિશન/દલાલી

*વાર્ષિક લેણદેણની અપેક્ષિત સંખ્યા 1 <250 2 250 - 500 3 500 - 1000 4 1000 - 2500 5 >2500

*અપેક્ષિત લેણદેણની રકમ (માં)

*રોકડ જમા- વાર્ષિક (માં) 1 0-1 લાખ 2 1-5 લાખ 3 5-10 લાખ 4 10 લાખ અને વધુ

*રોકડ ઉપાડ- વાર્ષિક (માં) 1 0-1 લાખ 2 1-5 લાખ 3 5-10 લાખ 4 10 લાખ અને વધુ

એક્સીવાય ઈન્વર્ડ- વાર્ષિક (યુએસડીમાં) 1 0-5 લાખ 2 5-10 લાખ 3 10-25 લાખ 4 25-50 લાખ 5 50 લાખ-1 કરોડ 6 1-5 કરોડ 7 5-10 કરોડ 8 >10 કરોડ

એક્સીવાય આઉટવર્ડ- વાર્ષિક (યુએસડીમાં) 1 0-5 લાખ 2 5-10 લાખ 3 10-25 લાખ 4 25-50 લાખ 5 50 લાખ-1 કરોડ 6 1-5 કરોડ 7 5-10 કરોડ 8 >10 કરોડ

*ડોમેસ્ટિક ઈન્વર્ડ (માં) 1 0-5 લાખ 2 5-10 લાખ 3 10-25 લાખ 4 25-50 લાખ 5 50 લાખ-1 કરોડ 6 1-5 કરોડ 7 5-10 કરોડ 8 >10 કરોડ

*ડોમેસ્ટિક આઉટવર્ડ (માં) 1 0-5 લાખ 2 5-10 લાખ 3 10-25 લાખ 4 25-50 લાખ 5 50 લાખ-1 કરોડ 6 1-5 કરોડ 7 5-10 કરોડ 8 >10 કરોડ

5. *તમારો બેન્ક વ્યવહાર આસાન બનાવવા માટે તમને શું જરૂર પડશે

ચેક બુક ☐ હા ☐ ના

નોંધ: i. ગત અથવા હયાતના સંચાલનના માધ્યમમાં હયાતને કોઈ ચેક બુક અથવા ડેબિટ કાર્ડ જારી નહીં કરાશે. ii. સંયુક્ત સંચાલન અકાઉન્ટ્સમાં કોઈ નેટ બેલેન્સ અને ડેબિટ કાર્ડ જારી નહીં કરાશે. iii. તમે અકાઉન્ટ સક્રિય થયા પછી શાખામાંથી તમારી પર્સનલાઈઝ્ડ પાસબુક પ્રાપ્ત કરી શકો છો. iv. જો અકાઉન્ટ અંગૂઠાના નિશાન સાથે ખોલાવવામાં આવે તો કોઈ ચેક બુક જારી નહીં કરાશે.

ડેબિટ કાર્ડ (એફડી/ આરડી /એસડી/ સંયુક્ત સંચાલિત અકાઉન્ટ માટે લાગુ નહીં)

1) અરજદાર:	☐ હા	☐ ના	કાર્ડનો પ્રકાર:	☐ ક્લાસિક/ટાઈટનિયમ	☐ પ્લેટનિયમ	☐ ઈન્સિગ્રિયા	☐ કેસ્ટ	☐ સિગ્નેચર+	☐ એન્ટરપ્રાઈઝ	☐ પિનેકલ	☐ અન્ય _____
2) અરજદાર:	☐ હા	☐ ના	કાર્ડનો પ્રકાર:	☐ ક્લાસિક/ટાઈટનિયમ	☐ પ્લેટનિયમ	☐ ઈન્સિગ્રિયા	☐ કેસ્ટ	☐ સિગ્નેચર+	☐ એન્ટરપ્રાઈઝ	☐ પિનેકલ	☐ અન્ય _____
3) અરજદાર:	☐ હા	☐ ના	કાર્ડનો પ્રકાર:	☐ ક્લાસિક/ટાઈટનિયમ	☐ પ્લેટનિયમ	☐ ઈન્સિગ્રિયા	☐ કેસ્ટ	☐ સિગ્નેચર+	☐ એન્ટરપ્રાઈઝ	☐ પિનેકલ	☐ અન્ય _____

ફક્ત આર-કિટ્સ માટે જારી							
લેણદેણ પ્રકાર એનેબલ કરો	એમેસ્ટિક	ઈન્ટરનેશનલ†		કાર્ડનો પ્રકાર	રોજની ડિઝીલ્ટ એટીએમ મર્યાદા	રોજની ડિઝીલ્ટ પીએનએસ અને એનલાઈન/સીએનપી મર્યાદા	#રોજની સંપર્કરહિત લેણદેણ મર્યાદા
એટીએમ	એનેબલ્ડ	☐ હા	☐ ના	પ્લેટિનમ/ક્રેડિટ	1 લાખ	2 લાખ	5,000/-
પોઈન્ટ ઓફ સેલ (પીએનએસ)	એનેબલ્ડ	☐ હા	☐ ના	ક્લાસિક	50,000/-	1 લાખ	5,000/-
એનલાઈન/સીએનપી^	☐ હા ☐ ના	☐ હા ☐ ના	☐ હા ☐ ના	મિઝનેસ/પ્લેટિનમ કાર્ડ	1 લાખ	2 લાખ	5,000/-
#સંપર્કરહિત લેણદેણ	☐ હા ☐ ના	☐ હા ☐ ના	☐ હા ☐ ના	રૂપે કાર્ડ	50,000/-	30,000/-	5,000/-

નોંધ: i. ફક્ત ઇએમપી કાર્ડ જારી કરાશે. ii. ભારતમાં એટીએમ અને પીએએસ લેણદેણ કિડોલ્ટી એનેબલ્ડ કરાશે. લેણદેણની કોઈ પણ અન્ય શ્રેણીઓ માટે આ ક્લોમમાં તમારા દ્વારા કરાયેલી પસંદગી અનુસાર સંબંધિત સેવિસ કરાશે. iii. ક્લોમ 60 અને એનેઆરઓ અકાઉન્ટ્સ સુપરટ કરનારા ગ્રાહકોને લોમેસ્ટિક કાર્ડ્સ જ પૂરું પડાય છે. iv. જો ચોક્કસ સેગમેન્ટ / અકાઉન્ટનો પ્રકાર તમે મેપ્ડ કરો તો સંબંધિત સેગમેન્ટ / અકાઉન્ટના પ્રકાર માટે ડેબિટ કાર્ડ જારી કરાશે. v. કિડોલ્ટ મર્યાદા (ઉક્ત યાદી અનુસાર) લોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ લેણદેણ માટે પણ લાગુ થશે. આ મર્યાદા તમારી પસંદગી અનુસાર સક્રિય કરાશે. તમે ઇન્ટરનેટ બેન્કિંગ/ મોબાઈલ બેન્કિંગ / આઈવીઆર શાખા થકી ડેબિટ કાર્ડ જારી કર્યા પછી લેણદેણ અધિકારો / મર્યાદાઓ એનેબલ / નિષ્ક્રિય / સુધારણા પણ કરી શકો છો. vi. નોન આર-કિટના કિસ્સામાં તમારું ડેબિટ કાર્ડ ‘અસક્રિય’ સ્થિતિમાં તમને મોકલવા છે/ મોકલાશે. ડેબિટ કાર્ડ સક્રિય કરવા તમારે સૌપ્રથમ તમારો પિન જારી કરવાનું આવશ્યક છે.

¹સીએનપી- કાર્ડ નોટ પ્રેઝન્ટ ટ્રાન્ઝેક્શન્સ (ઓનલાઈન ઈ-કોમર્સ, આઈપીઆર, ઓન-કોલ/ ફોન ઓર્ડર્સ, લેણદેણ વગેરે)

#ફક્ત સંપર્કરહિત ડેબિટ કાર્ડસ માટે †ફક્ત ઈન્ટરનેશનલ ડેબિટ કાર્ડસ

મને /અમને પસંદ કરાયેલા કાર્ડના શુલ્કની માહિતી આપવામાં આવી છે અને હું /અમે અત્રે લિંકડ અકાઉન્ટ્સમાંથી આ શુલ્ક કાપી લેવાની સંમતિ આપીએ છીએ.

Signature of Applicant 1
(Only in case R-kit is issued)

વૈકલ્પિક એસએમએસ એલર્ટ ☐ હા ☐ ના	કૃપા કરી ધ્યાનમાં રાખો કે વૈકલ્પિક એલર્ટ સેવિંગ્સ અકાઉન્ટ માટે 2000થી વધુ રકમ અને કરન્ટ અકાઉન્ટ્સ માટે 5000થી વધુ રકમ માટે જ મોકલવામાં આવશે.
વૈકલ્પિક ઈમેઈલ એલર્ટ ☐ હા ☐ ના	વૈકલ્પિક એલર્ટ્સ પર શુલ્ક લાગુ છે. કૃપા કરી વિગતો માટે શુલ્કની સમયસૂચી જુઓ. કૃપા કરી ધ્યાનમાં રાખો કે તમને વ્યવહારની રકમ ગમે તેટલી હોય તો પણ નિઃશુલ્ક કરજિયાત એલર્ટ્સ માળા થતા રહેશે.

6. *ફિલ્ડિંગનું માધ્યમ

આરંભિક રકમ શબ્દોમાં

☐ રોકડ^

☐ ચેક નં. @ તારીખ કોને નામે અગા બેન્ક શાખા

☐ મારા આરબીએલ બેન્ક અકાઉન્ટ નંબરમાંથી ડેબિટ કરો

^જો અકાઉન્ટ ખોલાવવાની આરંભિક રકમ રોકડમાં હોય તો ગ્રાહકે વ્યક્તિગત રીતે શાખામાં જવું પડશે અને વિધિસર રસીદ પ્રાપ્ત કરવી પડશે (સીએએસએ માટે જ લાગુ).

અસ્વીકાર: જો અકાઉન્ટમાં પૂરું ભંડોળ નહીં હોય તો લાગુ સેવા શુલ્કની વસૂલી માટે તેની પર બેન્ક દ્વારા ભારણ એવું નિશાન કરાશે.

@ચેક કોસ્ટ અકાઉન્ટ પેચી હોવો જોઈએ અને 'આરબીએલ બેન્ક લિ. અકાઉન્ટ <અરજદારનું નામ>' નામે હોવો જોઈએ.

7. ડિપોઝિટની વિગતો

હું/અમે બુક કરવા માગીએ છીએ ☐ કોલેબલ એક્ડી ☐ નોન-કોલેબલ એક્ડી (મુદત નમૂનામાં ઘોષણા ફરજિયાત છે.) ☐ ટેક્સ સેવર એક્ડી: (મુદત- 5 વર્ષ લોક-ઈન)

રકમ મૂલ્ય તારીખ (આરડીના કિસ્સામાં મૂલ્ય તારીખ એસઆઈ તારીખ રહેશે)
(*મૂલ્ય તારીખ ભંડોળની સ્પષ્ટ ઉપલબ્ધતાને આધીન અપાશે)

શબ્દોમાં રકમ રોકડ^

☐ ચેક નં. @ તારીખ કોને નામે અગા બેન્ક શાખા

☐ મારા આરબીએલ બેન્ક અકાઉન્ટ નંબરમાંથી ડેબિટ કરો

^જો અકાઉન્ટ ખોલાવવાની આરંભિક રકમ રોકડમાં હોય તો ગ્રાહકે વ્યક્તિગત રીતે શાખામાં આવવું પડશે અને વિધિસર રસીદ પ્રાપ્ત કરવી પડશે. (ફક્ત સીએએસએ માટે લાગુ)

@ચેક કોસ્ટ અકાઉન્ટ પેચી હોવો જોઈએ અને 'આરબીએલ બેન્ક લિ. અકાઉન્ટ <અરજદારનું નામ>' નામે હોવો જોઈએ.

મુદત મહિના દિવસ

વ્યાજની ચુકવણીનો વિકલ્પ ☐ મેચ્યુરિટી સમયે ☐ માસિક (ફિસ્કાલ ઇર માસિક ચુકવણી માટે લાગુ થશે)
☐ ત્રિમાસિક ☐ વાર્ષિક

મેચ્યુરિટી સૂચના ☐ મૂળ રકમ અને વ્યાજનું નવીનીકરણ કરો ☐ મૂળ રકમ અને પુનઃચુકવણી વ્યાજનું
☐ નવીનીકરણ નહીં કરો- મૂળ રકમ અને વ્યાજ નવીનીકરણ કરો

વ્યાજ /મેચ્યુરિટી ચુકવણી કોને ☐ ડીડી/પીઓ અથવા ☐ અન્ય બેન્કનું નામ

☐ અકાઉન્ટ નંબર આઈએફએસી કોડ

જો તમે અન્ય બેન્કમાં ફિક્સ ડિપોઝિટ મેચ્યુરિટી પ્રાપ્તિ જમા કરાવવા માગતા હોય તો કૃપા કરી લાભાર્થી બેન્કનો કેન્સલ્ડ ચેક અમને પૂરો પાડો.

વ્યાજ દર: % વાર્ષિક

વ્યાજની ચુકવણીની સાતત્યતા ☐ તિથિ દિવસો ☐ ડિપોઝિટ એનિવર્સરી

☐ હું/ અમે મારા/ અમારા સેવિંગ/કરન્ટ અકાઉન્ટમાં ઓટો સ્વીપ સુવિધા (મની મેક્સ સુવિધા) સક્રિય કરવા માગીએ છીએ. આ સુવિધા હેઠળ હું/ અમે વિનંતી કરીએ અને સંમતિ આપીએ છીએ કે ફિક્સ ડિપોઝિટ્સ (એક્ડી) 181 દિવસ અને રોજની બુકિંગ સાતત્યતાની ફિક્સ મુદત સાથે નિર્માણ કરી શકાય. સ્વીપ-આઉટ થ્રેસહોલ્ડ (એવી રકમ જેની ઉપર ટર્મ ડિપોઝિટ નિર્માણ કરવી જોઈએ) સંબંધિત અકાઉન્ટને લાગુ માસિક/ ત્રિમાસિક સરેરાશ બેલેન્સ (એમએબી/ ક્યુએબી)ની બેગણી અથવા રૂ. 50,000થી ઉચ્ચ રહેશે. એક એક્ડી રૂ. 5000ની લઘુત્તમ રકમ માટે અને કથિત થ્રેસહોલ્ડથી વધુ નહીં તેવી બેલેન્સમાંથી નિર્માણ કરવી જોઈએ અને તે પછી રૂ. 5000ના ગુણકમાં, મહત્તમ રૂ. 25,00,000 સુધી.

શું પ્રથમ અરજદાર વરિષ્ઠ નાગરિક છે ☐ હા (જો હા હોય તો બેન્કની કેવાયસી અનુસાર ઉંમરનો પુરાવો દર્શાવવા માટે દસ્તાવેજની નકલ જોડો) ☐ ના

સ્વીપ-ઈન સુવિધા સૂચના: ☐ હા ☐ ના આરબીએલ સેવિંગ / કરન્ટ અકાઉન્ટ નંબર લિંક કરો

(ઓટો સ્વીપ સુવિધા સિવાય બુક કરેલી ફિક્સ ડિપોઝિટ માટે જ લાગુ (મની મેક્સ સુવિધા))

કોઈ પણ ચેનલ થકી બુક કરાવવામાં આવેલી સંચુકત એક્ડીના પ્રીમેયર ઉપાડ માટે અને જ્યાં સંચાલનનું માધ્યમ 'બેમાંથી એક અથવા હયાત' અથવા 'ગત અથવા હયાત' હોય ત્યાં હું/ અમે સંમતિ આપીએ છીએ કે ડિપોઝિટરના મૃત્યુના સંજોગોમાં બેન્ક વિનંતી પર હયાત/તોને પ્રીમેયર રીતે ફિક્સ ડિપોઝિટની પ્રાપ્તિઓ ચૂકવીને પોતાની ફરજ પૂરી કરશે.

કોલેબલ ડિપોઝિટ્સ- ગ્રાહકો આંશિક/ સંપૂર્ણ પ્રીમેયર ઉપાડ કરી શકે છે.

નોન- કોલેબલ ડિપોઝિટ્સ- ગ્રાહકો પ્રીમેયર ઉપાડ નહીં કરી શકે.

નોંધ: i. જો ફિક્સ ડિપોઝિટની મેચ્યુરિટી પૂર્વે અમને નિર્દિષ્ટ સૂચના પ્રાપ્ત નહીં થાય તો અમે ડિપોઝિટની મેચ્યુરિટી/નવીનીકરણના દિવસે પ્રવર્તમાન લાગુ વ્યાજ દરે ફિક્સ ડિપોઝિટની મૂળ મુદત માટે ફિક્સ ડિપોઝિટ નવીનીકરણ કરીશું. એક્ડીના સંપૂર્ણ /આંશિક મેચ્યુરિટી પૂર્વે ઉપાડ પર એક્ડી બેન્કમાં રહી હતી તે સમયગાળા માટે લાગુ દરે વ્યાજની ચુકવણી કરાશે, જે 1% દંડને આધીન રહેશે. ii. સ્વીપ-ઈન સૂચનાઓ હેઠળ પ્રીમેયર ઉપાડ માટે લિંક ટર્મ ડિપોઝિટ મેપ્ડ સેવિંગ/કરન્ટ અકાઉન્ટમાં અપૂરતી બેલેન્સ પરિપૂર્ણ કરવા માટે લાગુ પ્રીમેયર ધારા સાથે લાસ્ટ ઈન ઇસ્ટ આઉટ ધોરણે અપરિપક્વ તોડવામાં આવશે. આ સુવિધા પ્રથમ અકાઉન્ટ ધારક સેવિંગ/કરન્ટ અકાઉન્ટ અને ફિક્સ ડિપોઝિટ અકાઉન્ટમાં સમાન હોય તો મંજૂર કરાય છે. એક્ડી સામે ઓડી સુવિધા માણતા સેવિંગ/કરન્ટ અકાઉન્ટના કિસ્સામાં સ્વીપ-ઈન સુવિધા મંજૂર નહીં કરાશે. iii. આરડી/એસડીના પ્રીમેયર ઉપાડ પર વ્યાજ બેન્ક પાસે વાસ્તવમાં આરડી/ એસડી જેટલો સમય રહી હોય તે સમયગાળા માટે લાગુ દરે ગણતરી કરાશે, જે 1% દંડને આધીન રહેશે. ચૂકી જવાયેલા હસા માટે દંડ દરેક ચૂકી ગયેલા માસિક હસા માટે હસાની રકમના 1% હશે. આ દંડ મેચ્યુરિટીની રકમમાંથી કાપી લેવાશે. આરડી/એસડીની મેચ્યુરિટી પ્રાપ્તિ કાપી લેવાયેલા માસિક હસાના અકાઉન્ટમાં જ જમા કરાશે. iv. વરિષ્ઠ નાગરિક વ્યાજ મેળવવા માટે બેન્ક અકાઉન્ટમાં જન્મતારીખ અપડેટ કરાવવાની ખાતરી રાખવાની રહેશે. કર્મચારી અને વરિષ્ઠ નાગરિકો માટે ઉપલબ્ધ વિશેષ દરો એનઆરઈ / એનઆરઓ/ એક્સીએનઆર/આરએક્સ ડિપોઝિટ્સ માટે લાગુ નહીં થશે.

8. જીએસટીની વિગતો (જીએસટીઆઈએન આ ફોર્મ થકી ખોલાવવામાં આવતા અકાઉન્ટ સાથે જ મેપ્ડ કરાશે)

જીએસટીઆઈએન

9. *નોમિનેશન ફોર્મ ડીએ 1

(એ. કૃપા કરી ઉપલબ્ધ વિકલ્પમાંથી એકની પસંદગી કરો. બી. એપોઈન્ટી અને અકાઉન્ટ ધારક સમાન નહીં હોવા જોઈએ)

બેન્ક ડિપોઝિટ્સ સંબંધમાં બેન્કિંગ નિયમન ધારા 1949ની કલમ 45એડએ અને બેન્કિંગ કંપનીઝ (નોમિનેશન) રુલ્સ 1985ના નિયમ (2) હેઠળ નોમિનેશન:

- ☐ મને/અમને નોમિનેશન સુવિધા જોઈએ છે.
- ☐ મને/અમને નોમિનેશન સુવિધા જોઈતી નથી. હું/અમે સમજીએ છીએ અને પહેલું આપીએ છીએ કે મારા દ્વારા નહીં આપવામાં આવેલાં નોમિનેશન સાથે સંકળાયેલાં જોખમ અને પરિણામો છે.
- *હું/અમે નિમ્નલિખિત વ્યક્તિને નોમિનેટ કરીએ છીએ, જેને મારા /અમારા/સગીરના મૃત્યુના સંજોગોમાં અકાઉન્ટમાં ડિપોઝિટની રકમ આરબીએલ બેન્ક લિ. દ્વારા પરત કરવી.
- નોમિનેશનની વિગતો નિવેદન/પાસબુક પર પ્રદર્શિત કરવાની રહેશે: ☐ હા ☐ ના

ડિપોઝિટનો પ્રકાર	અજોડ નં.
વધારાની વિગતો (જો કોઈ હોય તો)	
નોમિનીનું નામ	
નોમિનીનું સરનામું	
ડિપોઝિટ સાથે સંબંધ (જો કોઈ હોય તો)	*નોમિનીની જન્મતારીખ
નોમિનીનો મોબાઈલ નંબર:	નોમિનીની ઈમેઈલ આઈડી

**નોમિની આ તારીખના રોજ સગીર હોવાથી હું નોમિનીની સગીરાવસ્થા દરમિયાન મારા/અમારા/ સગીરના મૃત્યુના સંજોગોમાં નોમિની વતી અકાઉન્ટમાં જમા રકમ પ્રાપ્ત કરવા ને નિયુક્ત કરીએ છીએ.

સગીર સાથે સંબંધ: _____ સરનામું: ☐ મુખ્ય અરજદારની સમાન
જો મુખ્ય અરજદારથી સરનામું અલગ હોય તો: _____

*1લા અરજદાર /અધિદ્વિતિ સહીકર્તા 1ની સહી	*2જી અરજદાર /અધિદ્વિતિ સહીકર્તા 2ની સહી	*3જી અરજદાર /અધિદ્વિતિ સહીકર્તા 3ની સહી
---	---	---

નામ _____ સહી*** _____ સરનામું _____ _____ તારીખ <table border="1" style="display: inline-table; text-align: center; width: 100px;"> <tr><td>D</td><td>D</td><td>M</td><td>M</td><td>Y</td><td>Y</td><td>Y</td><td>Y</td></tr> </table> સ્થળ _____	D	D	M	M	Y	Y	Y	Y	નામ _____ સહી*** _____ સરનામું _____ _____ તારીખ <table border="1" style="display: inline-table; text-align: center; width: 100px;"> <tr><td>D</td><td>D</td><td>M</td><td>M</td><td>Y</td><td>Y</td><td>Y</td><td>Y</td></tr> </table> સ્થળ _____	D	D	M	M	Y	Y	Y	Y
D	D	M	M	Y	Y	Y	Y										
D	D	M	M	Y	Y	Y	Y										

કંપનીનું નામ																			કંપનીનો કોડ												
એમ્પ્લોયી કોડ							હોલ્ડો																								
નિયુક્ત અધિકારીનું નામ																							તારીખ	D	D	M	M	Y	Y	Y	Y
નિયુક્ત અધિકારીની સહી												કંપનીનું સીલ																			

હું/અમે ઘોષિત કરીએ, સમર્થન આપીએ, સંમતિ આપીએ છીએ કે:

એ. અરજી ફોર્મમાં આપવામાં આવેલી સર્વ વિગતો અને માહિતી સર્વ સંબંધમાં સાચી, અચૂક, સંપૂર્ણ અને અદ્યતન છે અને મેં/ અમે કોઈ માહિતી છુપાવી નથી.

બી. મારી/ અમારી સામે પણ નાદારીની કાર્યવાહી થઈ નથી કે મને /અમને નાદાર જાહેર કરાયા નથી.

સી. 'વિદેશી યોગદાન (નિયમન) ધારા 2010 અને વિદેશી યોગદાન (નિયમન) નિયમ 2011' હેઠળ યોગદાન

- હું/અમે સમર્થન આપીએ છીએ કે નિયમિત સંચાલનના ભાગરૂપે મને/ અમને વિદેશીની કોઈ પણ યોગદાન પ્રાપ્ત થતું નથી અને જો ભવિષ્યમાં અમને તે પ્રાપ્ત થાય તો અમે પૂરતી સૂચના સાથે અગાઉથી નેન્ડકને જાણ કરીશું. અથવા
- હું/ અમે સમર્થન આપીએ છીએ કે નિયમિત સંચાલનના ભાગરૂપે અમને વિદેશી યોગદાન પ્રાપ્ત થાય છે. આવી એક્સીઆરએ કેડિટ્સ માટે _____ નેન્ડકમાં પ્રાપ્ત ખોલવામાં આવેલા એક્સીઆરએ અકાઉન્ટમાં વિદેશી યોગદાન જમા કરવા માટે ગૃહ બાબતોના મંત્રાલય (એમએચએ) પાસેથી અલગથી મંજૂરી પ્રાપ્ત કરવામાં આવી છે, અને હું / અમે સમર્થન આપીએ છીએ કે આગળીએ નેન્ડકમાં અકાઉન્ટમાં કોઈ વિદેશી યોગદાન જમા નહીં કરીએ. હું/અમે એ પણ સમર્થન આપીએ છીએ કે એક્સીઆરએ અકાઉન્ટ વિશિષ્ટ અને નેન્ડ તથા શાખા વિશિષ્ટ માટે મંજૂરી પ્રાપ્ત કરી છે.
- 'અન્ય એક્સીઆરએ અકાઉન્ટ' ખોલાવવા માટે અમે એસબીઆઈ નવી ટિલ્લી મુખ્ય શાખામાં ઘરાવાતા અમારા 'એક્સીઆરએ અકાઉન્ટ' માટે ગૃહ બાબતોના મંત્રાલય (એમએચએ) પાસેથી મંજૂરી સુપરત કરીશું અને 'એક્સીઆરએ યુટિલાઈઝેશન અકાઉન્ટ' ખોલાવવા માટે અમે એસબીઆઈ નવી ટિલ્લી મુખ્ય શાખામાં ઘરાવાતા 'એક્સીઆરએ અકાઉન્ટ' માટે અને જો વિદેશી યોગદાન (નિયમન) ધારા 2010 અને તેના હેઠળ કોઈ પણ માર્ગદર્શિકાઓ, નિયમો અને નિયમોનાનું પાલન કરીને 'અન્ય એક્સીઆરએ અકાઉન્ટ' ખોલાવવામાં આવે તો એમએચએ મંજૂરી સુપરત કરીશું.
- અમે પ્રમાણિત કરીએ છીએ કે આ ખોલવામાં આવેલું એકમાત્ર 'અન્ય એક્સીઆરએ અકાઉન્ટ' છે અને અમે કોઈ પણ અન્ય 'એક્સીઆરએ અકાઉન્ટ' ઘરાવાતા નથી.

અરજી પ્રાપ્ત ☐ સેવિંગ્સ ☐ કરન્ટ ☐ ફિક્સ્ડ ડિપોઝિટ ☐ રિકર્વિંગ ડિપોઝિટ ☐ સ્માર્ટ રિકર્વિંગ ડિપોઝિટ

આરંભિક ચુકવણીની વિગતો

આરંભિક રકમ ₹ શબ્દોમાં _____

☐ રોકડ ₹

☐ ચેક નં. તારીખ કોને નામે અદા _____ બેન્ક _____ શાખા _____

☐ મારા આરબીએલ બેન્ક અકાઉન્ટમાંથી ડેબિટ

Note: DD/PO/Cheque subject to clearance

રકમ _____ મુદત _____ વ્યાજ દર _____ % વાર્ષિક

Only for FD or RD - Monthly Installment

યોગ્ય રીતે સંપૂર્ણ ભરેલું નોમિનેશન ફોર્મ ડીએ 1 પ્રાપ્ત થયું ☐ હા ☐ ના એમ્પ્લોયી આઈડી

બેન્ક અધિકારીનું નામ (તપાસકર્તા) _____



Please Quote your reference No. for any communication

Date | D | D | M | M | Y | Y | Y | Y |

 वेबसाइट:
www.rbl.bank.in

ડેબિટ કાર્ડ:
કક્ષામાં ઉત્તમ વિશિષ્ટતાઓ અને
લાભો. તમને ઉત્તમ અનુકૂળ
એકની પસંદગી કરો.

12. *ઘોષણા (ચાલુ....)

- v. આરબીએલ બેન્કમાં જોલાવવામાં આવેલા ‘અન્ય એક્સીઆરએ અકાઉન્ટ’માં કોઈ રેમિટન્સ/ વિદેશી યોગદાન જમા નહીં કરાવીશું અને સર્વ ક્રેડિટ્સ એસબીઆઈ નવી દિલ્લી મુખ્ય શાખામાં ધરાવાતા ‘એક્સીઆરએ અકાઉન્ટ’માંથી કરાશે. જો આરબીએલમાં ‘એક્સીઆરએ ચુલિલાઈઝેશન અકાઉન્ટ’ જોલાવવામાં આવે તો સર્વ ક્રેડિટ્સ એસબીઆઈ નવી દિલ્લી મુખ્ય શાખામાં ધરાવાતા ‘એક્સીઆરએ અકાઉન્ટ’ અથવા ‘અન્ય એક્સીઆરએ અકાઉન્ટ’માંથી કરાશે.
- દી. હું/અમે સમર્થન આપીએ છીએ કે આરબીએલ બેન્કમાં અકાઉન્ટ જોલાવવા માટે મેં / અમે આપેલો મોબાઈલ નંબર અને ઈમેઈલ આઈડી આરબીએલ બેન્ક પાસે ધરાવાતા કોઈ પણ અન્ય અકાઉન્ટ સાથે નોંધાણીકૃત નથી. જો આવા અકાઉન્ટનું અસ્તિત્વ મળી આવે તો નવું અકાઉન્ટ જોલાવવામાં નહીં આવી શકે અને નવા અકાઉન્ટ પર ફીઝ એવું નિશાન કરાઈ શકે છે.
- દ. એ. આરબીએલ બેન્ક પોતાના ક્લાર્ક ઓફર કરતી પ્રોડક્ટો, સેવાઓ અથવા પ્રમોશનલ ઓફરો વિશે પોતાની મેળે અથવા સહયોગમાં અથવા ભાગીદારો/ થર્ડ પાર્ટીઓ સાથે જોડાણમાં તમને માહિતગાર કરવા માંડેલો માહિતી મોકલવા /તમારો સંપર્ક કરવા સમયોત્તરે અરજી ફોર્મમાંની તમારી અંગત વિગતોનો ઉપયોગ કરી શકે છે. નીચે અગ્રતા આપીને એસએમએસ, ફોન કોલ્સ અને ઈમેઈલ થકી તમારો સંપર્ક કરવા આરબીએલને મંજૂરી આપી શકો અથવા નાકરી શકો છો. ☐ હા, બેન્ક મારો સંપર્ક કરી શકે છે. ☐ ના, બેન્ક મારો સંપર્ક નહીં કરી શકે.
- બી. હું /અમે બેન્કને તેના ક્લાર્ક ઓફર કરતી કોઈ પણ પ્રોડક્ટ / સેવાઓના માંડેલો / ઓફર/વેચાણના હેતુથી ‘સેવાઓ / પ્રોડક્ટો’ની જોગવાઈ માટે બેન્ક જેમની સાથે વ્યવસ્થા કરી હોય / કરવાનો હેતુ હોય તે ચૂપચાપ કંપનીઓ /સહયોગીઓ/ સેવા પ્રદાતાઓ /સનસિડિયરીઓ/ સંલગ્નિતો /સંયુક્ત સાહસો /કોઈ પણ વ્યક્તિને મારા/ અમારા ક્લાર્ક/સંબંધી પૂરી પડાયેલી માહિતી/ ડેટા, મારી/ અમારી કોઈ પણ વધુ ચોક્કસ સંમતિ અથવા અધિકૃતિ વિના કોઈ પણ સેવા પ્રદાતાઓને કોઈ પણ રીતે આદાનપ્રદાન, જાહેર, લેાઉટા અથવા ઉપયોગ કરવા અધિકૃતિ આપીએ છીએ.
- ☐ હા ☐ ના, હું મારી માહિતી/ ડેટા આદાનપ્રદાન, જાહેર કે ઉપયોગ કરવા મારી સંમતિ આપતો નથી.
- એફ. હું અત્રે જાહેર કરું છું કે કોઈ પણ અન્ય બેન્ક/ શાખામાં બેંકિંગ સેવિસ બેન્ક ડિપોઝિટ અકાઉન્ટ (બીએસબીડીએ) જાળવતો નથી (બીએસબીડી અકાઉન્ટના કિસ્સામાં લાગુ).
- ☐ હા ☐ ના
- જી. ડેબિટ કાર્ડસ માટે હું /અમે અત્રે બેન્કને અધિકૃતિ અને સંમતિ આપીએ છીએ કે તે મને /અમને કોઈ પણ સૂચના આપ્યા વિના બેન્ક પાસેથી ઉપલબ્ધ અકાઉન્ટ સંબંધી સેવાઓ અને પ્રોડક્ટો સંબંધમાં અરજી ફોર્મ(મો) /સંબંધિત દસ્તાવેજોની અમલજવાણીમાં મારા /અમારા ક્લાર્ક આપવામાં આવેલી માહિતી બેન્કની શાખાઓ /સનસિડિયરીઓ/સંલગ્નિતો, સેવા પ્રદાતાઓ, કેવાયસી ઈન્ફર્મેશન વેરિફિકેશન માટે થર્ડ પાર્ટીઓને અથવા બેન્કને અનુકૂળ લાગી શકે તે અન્ય સંબંધિત હેતુઓ માટે જાહેર કરી શકશે. હું /અમે અત્રે કારણની ગોપનીયતા અને ગુપ્તતાના વિશેષાધિકાર અભિવ્યક્ત રીતે માફ કરીએ છીએ.
- હું અત્રે ઓળખ/ સરનામાના પુરાવા સ્થાપિત કરવાના હેતુથી આરબીએલ બેન્કને ચુઆઈડીએઆઈ (આધાર) દ્વારા વ્યાખ્યા કરેલાં નાચોમેટ્રિક આધારિત ઈ-કેવાયસી ખરાઈ અથવા ઓફલાઈન વેરિફિકેશન માધ્યમો, કેવાયસી હેતુઓ માટે મારી પોતાની મરજીથી સ્વૈચ્છિક રીતે સુપરત કરું છું. હું વધુમાં આરબીએલ બેન્કને એ પણ અધિકૃતિ આપું છું કે તે ચુઆઈડીએઆઈમાંથી મારી વિગતોની ખરાઈ કરવા માટે મારો આધાર નંબર અને / નાચોમેટ્રિક/જનસાંખ્યિક માહિતીનો ઉપયોગ કરી શકે છે. હું સમજું છું કે આરબીએલ બેન્ક ચુઆઈડીએઆઈ પાસેથી ડેટા મગાવી શકે છે અને તે મારા ક્લાર્ક અપનાવવામાં આવેલી પ્રોડક્ટ/ સેવાઓ પૂરી પાડવા માટે આરબીએલ બેન્ક પાસે સંગ્રહ કરાશે. હું અત્રે આરબીએલ બેન્કને અરજી ફોર્મમાં મારા ક્લાર્ક આપ્યા મુજબ નોંધાણીકૃત મોબાઈલ નંબર /ઈમેઈલ સરનામા પર એસએમએસ/ ઈમેઈલ થકી સંકેતવાચસી રજિસ્ટ્રી પરથી માહિતી પ્રાપ્ત કરવા મારી સંમતિ આપું છું.
- હું/અમે અત્રે સંકેતવાચસી રજિસ્ટ્રી પર આવશ્યક માહિતી અપલોડ કરવા સંમતિ આપીએ છીએ. હું અત્રે મારી ઓળખ અને સરનામાની ખરાઈ કરવાના હેતુથી સંકેતવાચસી રજિસ્ટ્રી પરથી મારા રેકૉર્ડ્સ ડાઉનલોડ અને સંગ્રહ કરવા મારી સંમતિ આપું છું. હું સમજું છું કે મારા કેવાયસી રેકૉર્ડમાં મારું નામ, સરનામું, જન્મતારીખ, પેન નંબર વગેરે જેવી મારા કેવાયસી રેકૉર્ડ્સ /અંગત માહિતીનો સમાવેશ થાય છે.
- ☐ મારી કસ્ટમર આઈડી હેઠળ અપડેટેડ મારી કેવાયસી વિગતોમાં કોઈ ફેરફાર નથી. (જો લાગુ હોય તો નિશાન કરો, અન્યથા નવું સીઆઈએફ સુપરત કરો).

હું/અમે ઓટો સ્વીપ સુવિધા (મની મેક્સ સુવિધા) માટે નિમ્નલિખિત મુજબ સંમત છીએ, બાંધધરી આપીએ અને ઘોષિત કરીએ છીએ:

1. પેન સ્વીપ આઉટ/ ઈન સુવિધા મેળવવા ફરજિયાત છે. ફિક્સ્ડ ડિપોઝિટ્સ લાગુ વ્યાજ દરે ઉકત ઉલ્લેખિત ડિફરેન્સ મુદત માટે જ રચાઈ છે.
2. સ્વીપ-ઈન સુવિધા સ્વીપ-આઉટ સુવિધા થકી બુક કરાયેલી ફિક્સ્ડ ડિપોઝિટ(ટર્મ) પર ડિફરેન્સની એનેબલ્ડ કરાશે.
3. ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી) અકાઉન્ટ પ્રત્યેક રૂ. 5000ના ચુનિટમાં નિર્માણ કરાશે. એક ફિક્સ્ડ ડિપોઝિટ દિવસના અંતે લિંક્ડ અકાઉન્ટમાં ઉપલબ્ધ વધારાના ફંડ માટે બુક કરાશે.
4. ઉપાડ/ સ્વીપ-ઈન સુવિધા અપોઆપ રહેશે અને એટીએમ થકી પેમેન્ટ, ક્લિયરિંગ/ કલેક્શનમાં પ્રાપ્ત ચેક અથવા ડાઉનટર્મમાં કોઈ અન્ય માધ્યમથી અથવા સેવિસ/ કરન્ટ અકાઉન્ટમાંથી બંડોળના ટ્રાન્સફર માટે મારી/ અમારી ચોક્કસ વિનંતી થકી ચુકવણીને ખાતે ઉપાડ/ ઓવરડ્રાફ્ટની આવશ્યકતાને પહેંચી ગળવા માટે એલઆઈએફઓ ઘોરણે (લાર્ડ ઈન ફર્સ્ટ આઉટ)માં રૂ. 1000ના ગુણાંકમાં રહેશે. આ રીતે ઉપાડવામાં આવેલી એફડી ઉપાડની તારીખથી વ્યાજ કમાણી નહીં કરશે અને ઉપાડની તારીખથી વ્યાજ, જો ચુકવવાપાત્ર હોય તો આરબીઆઈના નિર્દેશ/ બેન્કની નીતિ અનુસાર ચુકવવામાં આવશે. જો લઘુતમ બેલેન્સની આવશ્યકતામાં રકમ ઓછી પડે તો સ્વીપ-ઈન સુવિધા થકી પરિપૂર્ણ નહીં કરાશે.
5. પ્રીમેયરોર ઉપાડ: પ્રીમેયરોર કલોઝર પેનલ્ટી બેન્કની નીતિ અનુસાર સંપૂર્ણ ઉપાડની રકમ માટે લાગુ થશે. જોકે બેન્કમાં ડિપોઝિટ રહી હોય તે સમયગાળા માટે એફડીની નિર્મિતીના સમયે કરારબદ્ધ દર અનુસાર વ્યાજ દર લાગુ થશે.
6. ફિક્સ્ડ ડિપોઝિટની રસીદ સ્વીપ-આઉટ સુવિધા થકી બુક કરેલી ટર્મ ડિપોઝિટ માટે પૂરી નહીં પડાશે.
7. લોન/ ઓવરડ્રાફ્ટ સુવિધા કથિત એફડી સામે નહીં અપાશે.
8. નોમિનેશન: હું/અમે મની મેક્સ સુવિધા થકી બુક કરેલી ડિપોઝિટો માટે મારા/ અમારા સેવિસ / કરન્ટ અકાઉન્ટમાં નોંધાણીકૃત નોમિનેશન ધ્યાનમાં લેવા બેન્કને અધિકૃતિ આપીએ છીએ.
9. હું/અમે સમજીએ છીએ કે સ્વીપ-આઉટ સુવિધા સ્વ- સંચાલિત માઈનર અકાઉન્ટમાં ઉપલબ્ધ નહીં થઈ શકે.
10. સ્વીપ-આઉટ સુવિધા થકી બુક કરેલી એફડી પર વ્યાજ મેચ્યુરિટી સમયે ચુકવવાપાત્ર રહેશે અને માસિક અથવા ત્રિમાસિક વ્યાજની ચુકવણીના વિકલ્પો ઉપલબ્ધ નહીં થશે.
11. સર્વાઈવરશિપ ધારા: ‘નેમાંથી એક અથવા હયાત’ અથવા ‘ભૂતપૂર્વ અથવા હયાત’ અથવા ‘કોઈ પણ એક અથવા હયાત/તો’ તરીકે સંચાલનના માધ્યમ સાથે અને આવી ડિપોઝિટ્સ માટે પ્રીમેયરોર લિક્વિડેશન માટે સ્વીપ-આઉટ ફિક્સ્ડ ડિપોઝિટ્સ થકી બુક કરાયેલી ફિક્સ્ડ ડિપોઝિટ્સ, ફિક્સિંગ/ સ્માઈ ડિપોઝિટ્સના કિસ્સામાં હું/અમે સર્વાઈવરશિપ ધારા સાથે સંયુક્ત ફિક્સ્ડ ડિપોઝિટના કિસ્સામાં, જો એક ડિપોઝિટરનું મૃત્યુ થાય તો બેન્કની લાયબિલિટી વિનંતી પર હયાત/તોને પ્રીમેયરોર રીતે ફિક્સ્ડ ડિપોઝિટની પ્રાપ્તિએ ચુકવેલો નિભાવવામાં આવશે.
12. ટેક્સ એટ સોર્સ સમયોત્તરે પ્રવર્તમાન આવકવેસ ધારાની જોગવાઈઓ અનુસાર કાપવામાં આવશે. જો ટીડીએસની કપાતના સમયે ઉપાર્જિત વ્યાજ લાગુ ટીડીએસ વસૂલ કરવા માટે પૂરતું નહીં હોય તો ટીડીએસની રકમ વ્યાજ લાગુ કરવા સમયે મોજૂદ ફિક્સ્ડ ડિપોઝિટમાંથી કાપી લેવાઈ શકે છે.
13. હું/અમે સમજીએ છીએ કે ઓટો સ્વીપ સુવિધા નિષ્ક્રિય થવા પર કોઈ નવી ડિપોઝિટ અપોઆપ નિર્માણ નહીં થશે.
14. હું/અમે સમજીએ છીએ કે બેન્ક લાગુ નિયમો અને શરતોમાં ફેરફાર/ફેરબદલી/ સુધારણા કરી શકે છે અને અકાઉન્ટના નિયમો અને શરતો આરબીએલ બેન્કની વેબસાઈટ/ નજીકની શાખા પર ઉપલબ્ધ છે.
15. હું/અમે ઓટો- રિન્યુઅલ સુવિધા સાથે ફિક્સ્ડ ડિપોઝિટ જોલાવવા બેન્કને અધિકૃતિ આપીએ છીએ અને પ્રવર્તમાન લાગુ વ્યાજ દર સાથે કથિત સમયગાળા હેઠળ મેચ્યુરિટીના સમયે વ્યાજ અને મૂળ રકમનું નવીનીકરણ કરવાની અધિકૃતિ આપીએ છીએ.
16. હું/અમે ટર્મ ડિપોઝિટ માટે આરબીએલ બેન્કની નિમ્નલિખિત વેબસાઈટ પર મુકાયેલા સામાન્ય નિયમો અને શરતો સ્વીકારીએ છીએ: <https://www.rblbank.com/terms-and-conditions>.

14. સૌથી મહત્વપૂર્ણ નિયમો અને શરતો

સેવિસ અને કરન્ટ બેન્ક અકાઉન્ટ

1. અકાઉન્ટ સર્કિય કરવા પર ગ્રાહક નજીકની શાખામાં જઈને નિઃશુલ્ક પર્સનલાઈઝ્ડ પાસબુક અને/ અથવા ચેક બુક માટે વિનંતી કરી શકે છે. ગ્રાહકોને નોંધાણીકૃત ઈમેઈલ આઈડી પર માસિક ઈ-નિવેડન પ્રાપ્ત થશે. ગ્રાહકની વિશિષ્ટ વિનંતી પર પ્રત્યક્ષ નિવેડનો પૂર્ણ પાડવામાં આવશે. સેવિસ અકાઉન્ટમાંથી ચેકડ ઉપાડ (લાગુ મર્યાદાને આધીન) લાગુ મર્યાદાને આધીન પાસબુક અને ઓળખના દસ્તાવેજો જોડીને ઉપાડની સ્તિપનો ઉપયોગ કરીને મંજૂર કરાશે.
2. સેવિસ અકાઉન્ટનું વ્યાજ સમયોત્તરે બેન્ક દ્વારા જાહેર કરેલા દરે રોજની કલોઝિંગ બેલેન્સ પર ત્રિમાસિક ચુકવવામાં આવે છે. સેવિસ બેન્ક વ્યાજ દરમાં કોઈ પણ ફેરફાર અંગે એસએમએસ/ ઈમેઈલ/અથવા બેન્કને અનુકૂળ લાગે તે અન્ય માધ્યમથી ગ્રાહકોને માહિતગાર કરાશે. છેલ્લામાં છેલ્લા વ્યાજ દરો માટે ફૂપ કરી લોગ-ઓન કરો www.rblbank.in.
3. સર્વ પ્રત્યક્ષ ક્લિયરેબલ્સ ‘અગ્રતાના ટપાલના સરનામે’ અને ક્લિયરિંગ ક્લિયરેબલ્સ વર્તમાન નોંધાણીકૃત ઈમેઈલ આઈડી અને મોબાઈલ નં. પર મોકલવામાં આવશે.
4. બેન્ક નોંધાણીકૃત અદાકતીને ચુકવણી માટે અકાઉન્ટસમાંથી ઓટો ડેબિટ માટે સ્થાયી સૂચના (“એસઆઈ”) પૂરી પાડશે. બેન્ક બંડોળ ઓછું પડવાથી એસઆઈની કપાતમાં નિષ્ફળતા માટે અથવા એસઆઈની કામગીરીમાં સંકળાયેલી થર્ડ પાર્ટીઓ દ્વારા વિલંબ માટે ઉત્તરદાવી નહીં રહેશે.
5. બેન્ક શુલ્ક વેબસાઈટ અને શાખાની નોટિસ બોર્ડ પર પ્રદર્શિત શુલ્કની સમયસૂચિમાં સંકેત આપેલા દરે નિમ્નલિખિત સેવાઓ માટે લાગુ થશે:
 - ચેકડ ઉપાડ અને ઉપાડ, અકાઉન્ટસની શ્રેણીને આધારે મુકર લઘુતમ બેલેન્સની જાળવણી નહીં કરવી, એસએમએસ એલર્ટ્સ, રેમિટન્સીસ, અકાઉન્ટ કલોઝર શુલ્ક વગેરે.
6. ડેબિટ કાર્ડ ‘અસાફિય’ સ્થિતિમાં મોકલવા છે/ મોકલાશે. તે સર્કિય કરવા તમારે સૌપ્રથમ તમારો પિન ઊપજાવવાનું આવશ્યક છે. ભારતમાં એટીએમ અને પીઓએસ લેાઉટો ડિફરેન્સ સર્કિય થઈ જાય છે.
7. ડેબિટ કાર્ડના લેાઉટો અધિકારો / મર્યાદાઓ નિમ્નલિખિત વિકલ્પો થકી એનેબલ્ડ / નિષ્ક્રિય / સુધારી શકાય છે: ઈન્ટરનેટ બેન્કિંગ/ મોબાઈલ બેન્કિંગ / આઈપીઆર/ શાખા.
8. ડેબિટ કાર્ડ ફી www.rblbank.in >> Service Charges & Fees પર શુલ્કની સૂચિ અનુસાર લાગુ થશે.
9. ગ્રાહક દ્વારા લાગલગત 24 મહિના સુધી લેાઉટો નહીં કરાઈ હોય તેવા અકાઉન્ટસ (એટલે કે, નાણાકીય, બિન- નાણાકીય અથવા કેવાયસી અપડેશન) ‘ડોર્મન્ટ/ નિષ્ક્રિય અકાઉન્ટ’ તરીકે વર્ગીકૃત કરવામાં આવશે. આ પછી ગ્રાહક શાખામાં જાય અને અકાઉન્ટ સર્કિય કરવા માટે આવશ્યક દસ્તાવેજો આપે નહીં ત્યાં સુધી કોઈ પણ માધ્યમથી ચેકડ જમા અથવા ઉપાડ મંજૂર નહીં કરાશે.
10. બેન્ક અકાઉન્ટમાં ડિપોઝિટ્સ સમયોત્તરે નિયમ દ્વારા નિર્ધારિત રકમ સુધી ટીડીએસની જાણ કરી શકે છે. ડિપોઝિટ ઈન્સ્યુરન્સ પર વિગતો માટે ફૂપ કરી www.dicgc.org.in પર લોગ-ઓન કરો.
11. બેન્ક ડીએસની પાસે નોંધાણી કરાયું હોય કે નહીં તે છતાં મહત્વપૂર્ણ અકાઉન્ટ સંબંધિત માહિતી માટે ગ્રાહકનો સંપર્ક કરશે (દા.ત. અનધિકૃત લેાઉટો વગેરે).
12. બેન્ક ગ્રાહકની ફરિયાદના નિવારણ માટે તેની વેબસાઈટ www.rblbank.in પર ‘કસ્ટમર સર્વિસીસ’ હેઠળ પ્રદર્શિત ફરિયાદ નિવારણ નીતિ ધરાવે છે. તમારી ફરિયાદ નોંધાવવા માટે ફૂપ કરી નજીકની શાખામાં જાયો અથવા બેન્કની વેબસાઈટ www.rblbank.in પર કસ્ટમર સર્વિસીસ પર લોગ-ઓન કરો અથવા +91 22 6232 7777 પર કોલ કરો.

ફિક્સ્ડ ડિપોઝિટ્સ

1. શરબદ્ધ દરે વ્યાજ ત્રિમાસિક ચક્રપૂર્ણ કરાય છે. વ્યાજની ગણતરીના હેતુથી વર્ષ 365 દિવસનું ઘ્યાનમાં લેવાય છે. સંપૂર્ણ અથવા આંશિક ઉપાડ સાથે ડિપોઝિટના પ્રી-મેયરોર કલોઝર પર વ્યાજ 1% દંડને આધીન બેન્ક પાસે વાસ્તવમાં એફડી રહી હોય તે સમયગાળા માટે લાગુ દરે ચુકવશે. જો ડિપોઝિટ આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર લઘુતમ મુદતથી ઓછા સમય માટે બેન્ક પાસે રહી હોય તો કોઈ વ્યાજ ચુકવવાપાત્ર નહીં રહેશે.
2. ઈ-ફિક્સ્ડ ડિપોઝિટ રસીદો વર્તમાન નોંધાણીકૃત ઈમેઈલ આઈડી પર મોકલવામાં આવશે.
3. નવીનીકરણ, ડિપોઝિટરનું કલોઝર (સંપૂર્ણ અથવા આંશિક) માટે સૂચનાઓ મેચ્યુરિટી તારીખના 2 દિવસ પૂર્વે સુધી આપી શકાય છે. આપોઆપ નવીનીકરણ પર મેચ્યુરિટી મૂલ્યમાંથી જો કોઈ હોય તો ટીડીએસની નાદાનગી કરીને મેચ્યુરિટી તારીખથી નવીનીકરણ કરાશે. ટેક્સ સેવર ડિપોઝિટની મુદત 5 વર્ષ (લોક-ઈન) રહેશે. પ્રીમેયરોર ઉપાડ અથવા લોન અથવા કોઈ પણ અન્ય ભારણ મંજૂર નહીં કરાશે.
4. દરેક નાણાકીય વર્ષ માટે અને વ્યાર પછી દરેક બુક કરાતી નવી ડિપોઝિટ માટે એપ્રિલમાં નવું 15G/H સુપરત કરશે. પેન નં. વિના સુપર કરાયેલું ફોર્મ 15G/H માન્ય નહીં કરાશે અને પ્રક્રિયા નહીં કરાશે.
5. વ્યાજની ચુકવણી લાગુ દરે ટેક્સ કલેક્શન એટ સોર્સ (ટીડીએસ) ને આધીન રહેશે. પેન નં. વિના અરજી પર આવકવેરા ટેક્સ નિયમો અનુસાર ઉચ્ચ ટીડીએસ લાગુ થશે.
6. ડિપોઝિટના પ્રી-મેયરોર કલોઝર પર ચુકવવામાં આવેલું વધારાનું વ્યાજ મૂળ રકમમાંથી વસૂલ કરાશે. સોત ખાતે કપાયેલો અને સરકાર પાસે જમા કરાયેલો ટેક્સ રિફંડ નહીં કરાશે. ગ્રાહકો આવકવેરા પ્રશાસન પાસેથી રિફંડનો દાવો કરી શકે છે.

વિગતવાર નિયમો અને શરતો માટે ફૂપ કરી વિક્રિત કરો: www.rblbank.in >> Others >> Most Important Terms and Condition

(કૃપા કરી આ ફોર્મ કોરું હોય તો સહી નહીં કરો. કૃપા કરી સર્વ સુસંગત વિભાગો અને કટાર તમારા સંતોષમાં સંપૂર્ણ ભરાયાં છે તેની ખાતરી કરો અને ત્યાર પછી જ ફોર્મ પર સહી કરો)